

**પસંદગી સમિતિ, બાગાયત નિયામકની કચેરી, ગુજરાત રાજ્ય, કૃષિભવન, બી-બ્લોક,
પ્રથમમાળ, સેક્ટર-૧૦ એ, ગાંધીનગર**

જાહેરાત ક્રમાંક:- (DOH/201213/2) :- કૃષિ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડાની બાગાયત નિયામકશ્રીની કચેરીની વિવિધ જિલ્લા/તાલુકા કક્ષા હસ્તકની કચેરીઓમાં નીચે દર્શાવેલ વર્ગ-૩ ની જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે on line અરજીઓ મંગાવામાં આવે છે. આ માટે ઇચ્છા ધરાવતા ઉમેદવારે <http://ojas.guj.nic.in> પર તારીખ: ૧૫/૦૩/૨૦૧૩ (બપોરે ૧૪:૦૦ કલાક) થી તારીખ: ૦૪/૦૪/૨૦૧૩ (રાત્રીના ૨૩:૫૯ કલાક) દરમિયાન અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા તાજેતરનો Passport Size Photograph (15KB) અને Signature (15 KB) સાઇઝથી વધારે નહી તે રીતે JPG Format માં Scan કરી On line અરજીમાં Upload કરવાના રહેશે. ઉમેદવારે પોતાના બધાજ શૈક્ષણિક, વય, અને જાતિ તેમજ લાયકાતના પ્રમાણપત્રો પોતાની પાસે તૈયાર રાખવાના રહેશે. અને અરજી પત્રમાં તે મુજબની વિગતો ભરવાની રહેશે. ઉમેદવારોની પસંદગી હેતુ લક્ષી પ્રશ્નોવાળી O.M.R.પદ્ધતિથી લેવાતી પરીક્ષા દ્વારા કરવામાં આવશે. પરીક્ષા સંબંધિ બધીજ સૂચનાઓ મોબાઇલ નંબર પર SMS થી આપવામાં આવશે. આથી અરજી પત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવો અને પસંદગી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તે નંબર જાળવી રાખવો જરૂરી છે.

ભરવાપાત્ર જગ્યાઓના સંદર્ભે અનામતની ટકાવારી મુજબ જાતિવાર ભરવાની થતી જગ્યાઓ.

જા.ક્રમાંક	વિભાગ/ ખાતાનું નામ	વર્ગ-૩ સંવર્ગનું નામ	કુલ જગ્યા	બિન અનામત (સામાન્ય)		સા.શૈ.પ.વર્ગ		અનુ.જાતિ.		અનુ.જન.જાતિ		વિક લાંગ
				પુરૂષ	મહિલા	પુરૂષ	મહિલા	પુરૂષ	મહિલા	પુરૂષ	મહિલા	
બગત/ ૧/૨૦૧૩	બાગાયત નિયામકની કચેરી, ગુ.રા. ગાંધીનગર	બાગાયત મદદનીશ	૪૭	૧૮	૭	૮	૪	૨	૧	૫	૨	૧

(૨.) અનામત જગ્યાઓ ફક્ત મુળ ગુજરાતના સા.શૈ.પ.વ.ના, અનુસુચિત જાતિ તેમજ અનુસુચિત જન જાતિના પછાત વર્ગના ઉમેદવારો માટે જ અનામત છે.

- ❖ અનામત વર્ગોના ઉમેદવારો જો બિન અનામત જગ્યાઓ માટે અરજી કરશે. તો આવા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળશે નહિં.
- ❖ ઉમેદવારે ઓનલાઇન ફોર્મ ભરતી વખતે તેઓ અનામત કેટેગરીમાં અરજી કરવા માગે છે કે બિન અનામાત કેટેગરીમાં કરવા માગે છે. તે સ્પષ્ટ જણાવવું એક વખત ઓનલાઇન અરજી કર્યા બાદ ઓનલાઇન ફોર્મમાં દર્શાવેલ જાતિ/કક્ષામાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવા દેવામાં આવશે નહિં. જો કોઇ ઉમેદવાર પાછળથી આ બાબતે રજુઆત કરશે તો તેની રજુઆત સ્વીકારવામાં આવશે નહિં કે તેનો કોઇ પ્રત્યુત્તર આપવામાં આવશે નહી. ઉમેદવારોને ઉપરોક્ત સૂચના ધ્યાને લઇ તેનું અચૂક પણે પાલન કરવા જણાવવામાં આવે છે.
- ❖ વિવિધ કક્ષા માટેનું અનામતનું ધોરણ સરકારશ્રી ની પ્રવર્તમાન સૂચના પ્રમાણે રહેશે.
- ❖ મહિલાઓ માટેની જગ્યાઓ ૩૦ % મુજબ અનામત છે. જે તે કેટેગરી સામે સરભર કરાશે. મહિલા ઉમેદવારો માટેની અનામત જગ્યાઓ ઉપર જો લાયક મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહી થાય તો તે જગ્યા તે જ કેટેગરીના પુરૂષ ઉમેદવારોથી ભરવામાં આવશે.

- ❖ સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર વિધવા મહિલા ઉમેદવારો માટે પસંદગીમાં અગ્રતા આપવા માટે તેમને મળેલ કુલ ગુણના ૫ (પાંચ) ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે. પરંતુ તેઓએ ભરતી તથા નિમણૂક સમયે પુનઃલઝન કરેલ ન હોવા જોઈએ. ઉપરાંત સમિતિ માંગે ત્યારે તેના તમામ પુરાવાઓ અસલમાં રજૂ કરવાના રહેશે.
- ❖ માજી સૈનિક માટે કુલ જગ્યાઓનાં ૧૦ % મુજબ અનામત છે. જે જે તે કેટેગરી સામે સરભર કરાશે માજી સૈનિક માટેની અનામત જગ્યા જો લાયક માજી સૈનિક ન મળે તો તે જગ્યા જે તે કેટેગરીના અન્ય લાયક ઉમેદવારથી ભરવામાં આવશે.
- ❖ શારીરિક ખોડ ખાંપણવાળા ઉમેદવારોની અનામત જગ્યાઓ જે તે કેટેગરી સામે સમાવેશ કરવામાં આવશે.

(૩) પગાર ધોરણ :-

નાણાં વિભાગના તારીખ: ૧૬-૦૨-૨૦૦૬ તથા તારીખ: ૦૧/૦૮/૨૦૦૬, તથા તારીખ: ૦૬-૧૦-૨૦૧૧ ના ઠરાવ તથા સામાન્ય વહિવટી વિભાગના તા. ૦૪/૦૬/૨૦૦૯ ના ઠરાવની જોગવાઈઓને આધિન જે બોલીઓ/ શરતો/નિયમો નક્કી કરેલ છે. તે તેમજ હવે પછી વખતો વખત સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવે તે પગાર સબંધી બોલીઓ/શરતો/નિયમો ઉમેદવારને બંધનકર્તા રહેશે. પ્રવર્તમાન જોગવાઈઓને આધિન પ્રથમ પાંચ વર્ષ માટે રૂપિયા ૫૩૦૦/- ના માસિક ફીક્સ પગારથી લાયક ઉમેદવારને અજમાયશી ધોરણે નિમણૂક અપાશે. તે સિવાય અન્ય કોઈ ભથ્થાં કે લાભો મળવાપાત્ર રહેશે નહિં. ત્યાર બાદ પાંચ વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ થયાની ખાતરી થયા બાદ જાહેરાતમાં દર્શાવેલ બાગાયત મદદનીશ તાંત્રિક સંવર્ગ વર્ગ- ૩ તરીકે, પે બેન્ડ રૂપિયા ૫૨૦૦ – ૨૦૨૦૦ + ગ્રેડ પે રૂપિયા ૨૪૦૦/- ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર ઠરશે.

(૪) રાષ્ટ્રીયતા:-

ઉમેદવાર ભારતનો નાગરિક હોવા જોઈએ. અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ ના નિયમ-૭ હેઠળ કરવામાં આવેલ જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા પાત્રતા ધરાવતો હોવો જોઈએ.

(૫) શૈક્ષણિક લાયકાત

(૧) ગુજરાત કૃષિ યુનિવર્સિટી હેઠળની કોઈપણ શાળાનો ૨ વર્ષનો એગ્રીકલ્ચરનો ડિપ્લોમા કોર્સ કરેલ હોવો જોઈએ અથવા રાજ્ય સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટી, વિદ્યાપિઠ કે સંસ્થામાંથી રૂરલ સ્ટડીઝ (એગ્રીકલ્ચર) ની સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ

(૨) ગુજરાતી / હિન્દી અથવા બંને ભાષાનું પર્યાપ્ત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

(૬) કોમ્પ્યુટરની જાણકારી

સામાન્ય વહીવટ વિભાગના તારીખ: ૧૩/૦૮/૨૦૦૮ ના સરકારી ઠરાવ ક્રમાંક સીઆરઆર-૧૦-૨૦૦૭-૧૨૦૩૨૦-ગા.૫ થી થી નક્કી કરેલ અભ્યાસ ક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈપણ સરકાર માન્ય તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર / માર્કશીટ ધરાવતા હોવા જોઈએ. તથા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સરકાર દ્વારા માન્ય સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડીપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ-૧૦ અને ધોરણ – ૧૨ ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પસાર કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈશે. આ તબક્કે પ્રમાણપત્રો ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. પરંતુ નિમણૂક મેળવતા પહેલા આ પ્રમાણપત્ર અચૂક રજૂ કરવાનું રહેશે. અન્યથા નિમણૂક મેળવવાને પાત્ર ઠરશે નહિ.

(૭) વય મર્યાદામાં છુટછાટ:-

- ❖ મુળ ગુજરાતના હોય તેવા અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પુરૂષ ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં પાંચ (૫) વર્ષની છુટછાટ આપવામાં આવશે.
- ❖ બિન અનામત વર્ગના મહિલા ઉમેદવારોને ૫ (પાંચ) વર્ષની તથા મુળ ગુજરાતના હોય તેવા તમામ અનામત વર્ગના મહિલા ઉમેદવારને ૧૦ (દશ) વર્ષની ઉપલી વય મર્યાદામાં છુટછાટ આપવામાં આવશે. (આ છુટછાટમાં મહિલા માટેની છુટછાટ કે જે ૫ પાંચ વર્ષની છે તેનો પણ સમાવેશ થઈ જાય છે.)

❖ ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ ની જોગવાઈઓ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવા ઉમેદવારોની તરફેણમાં વય-મર્યાદા હળવી કરી શકાશે.

(૧) તા. ૦૪/૦૪/૨૦૧૩. ના રોજ ઉમેદવારની વય ૧૮ થી ઓછી નહીં અને ૨૮ થી વધુ નહીં તેટલી હોવી જોઈએ.

૧ ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો (સામાન્ય) ૧૯૬૭ ની જોગવાઈ મુજબ જે ઉમેદવારો સરકારી સરકારી સેવામાં હોય તેવા ઉમેદવારોની તરફેણમાં તેમજ જે ઉમેદવારો સારી શૈક્ષણિક લાયકાત અથવા અનુભવ અથવા બંને ધરાવતા ઉમેદવારની તરફેણમાં ઉપલી વય મર્યાદામાં નિયમોનુસાર છુટ છાટ મુકી શકાશે.

૨ મૂળ ગુજરાતના હોય તેવા અનામત વર્ગના, મહિલા, વિકલાંગ તેમજ માજી સૈનિકના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં નિયમોનુસાર નીચે મુજબ છુટ છાટ આપવામાં આવશે.

(૧) સામાન્ય મહિલા ઉમેદવારોને ૫ વર્ષ

(૨) અનામત વર્ગના પુરૂષ ઉમેદવારોને ૫ વર્ષ

(૩) અનામત વર્ગના મહિલા ઉમેદવારોને ૧૦ વર્ષ

(૪) વિકલાંગ પુરૂષ ઉમેદવારોને ૧૦ વર્ષ

(અનામત પુરૂષ ઉમેદવારોને ઉપર મુજબ પાંચ વર્ષની વધુ છુટ છાટ મળવાપાત્ર થશે.)

(૫) વિકલાંગ મહિલા ઉમેદવારોને..... ૧૫ વર્ષ

નોંધ:- ઉમેદવાર ૪૦ % કે તેથી વધુ ટકાવારી ખોડખાંપણની ધરાવતા હોવાનું સિવિલ સર્જનનું સર્ટીફિકેટ ધરાવતા હશે તો જ વિકલાંગ ઉમેદવાર તરીકે ઉપલી વયમર્યાદા અને અનામતનો લાભ મળશે.

(૬) માજી સૈનિક:- જે માજી સૈનિકે સળંગ છ માસથી ઓછી નહીં તેટલી ફરજ બજાવેલ હોય તેવા અને નોકરીમાંથી નિયમિત રીતે નિવૃત્ત થયા હોય તેવા માજી સૈનિકોને તેમણે બજાવેલ ખરેખર ફરજનો સમયગાળો, તેમની ઉંમરમાંથી બાદ કરતાં મળતી પરિણાત્મક ઉમર, ભરતી નિયમમાં ઠરાવેલ ઉપલી વયમર્યાદાથી ત્રણ વર્ષ કરતાં વધવી જોઈશે નહીં.

(૭) તમામ કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છુટછાટ સાથે કોઇપણ સંજોગોમાં નિયત તારીખે ઉમર ૪૫ વર્ષથી વધવી જોઈશે નહીં.

(૮) તમામ ઉમેદવારોનાં કિસ્સામાં જાતિનું પ્રમાણપત્ર, વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, વધારાની લાયકાત, અનુભવ અને નોન કિમિલિયર સર્ટીફિકેટ અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે.

૮. પરીક્ષા ફી:-

(૧) ફોર્મ ભરતી વખતે “ General ” કેટેગરી Select કરી હોય (દર્શાવી હોય) તેવા (PH તથા Ex. Servicemen કેટેગરી સિવાયના) તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે.

(૨) જે ઉમેદવારોએ ફી ભરવાની છે તેવા ઉમેદવારો જ્યારે OJAS વેબસાઇટ પર પોતાની અરજી સબમીટ કરે ત્યારે તેઓને અરજી ફી ભરવા માટે ઓન લાઇન ઉપલબ્ધ ચલનની ૩ નકલોની એક પાના ઉપર પ્રિન્ટ મેળવવાની સુચના મળશે. ઉમેદવારોએ આ પાનાની પણ પ્રિન્ટ મેળવી લેવાની રહેશે, ઉમેદવારોએ ચલન સાથે કોઇપણ કોમ્પ્યુટરરાઇઝ્ડ પોસ્ટ ઓફીસમાં જઇને, પરીક્ષા ફી પેટે રૂ.૧૦૦/- રોકડા + રૂ.૧૨/- પોસ્ટલ ચાર્જીસ ભરી દેવાના રહેશે. ચલનની એક નકલ પોસ્ટ ઓફીસ રાખી લેશે અને બે નકલ ઉમેદવારને સિક્કા / સ્ટીકર સાથે પરત આપશે. આ નકલ ઉમેદવારે સાચવી રાખવાની રહેશે અને પરીક્ષા સમયે કોલ લેટર સાથે અચૂક સાથે લાવવાની રહેશે.

(૩) “ General ” કેટેગરી Select કરનાર ઉમેદવાર ફી ભર્યાની નકલ સાથે નહીં લાવે તેવા ઉમેદવારોને પરીક્ષા હોલમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

(૪) અન્ય કોઇ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં.

- (૫) ઉમેદવારને ફી ભર્યા બાદ ૨૪ કલાકમાં જો SMS ન મળે તો તાત્કાલીક જે તે પોસ્ટ ઓફીસનો સંપર્ક કરવો
- (૬) પોસ્ટ ઓફીસમાં ફી ભરવાની છેલ્લી તા. ૦૬/૦૪/૨૦૧૩ (કચેરી સમય સુધી) ની રહેશે.
- (૭) અરજી ફોર્મમાં નીચે મુજબની કેટેગરી Select કરનાર ઉમેદવારોએ કોઇપણ પ્રકારની પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં
- (ક) અનુસૂચિત જાતિ (SC)
- (ખ) અનુસૂચિત જન જાતિ (ST)
- (ગ) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ (SEBC)
- (ઘ) માજી સૈનિક (Ex.Serviceman) તમામ કેટેગરીના
- (ચ) શારિરીક ખોડખાંપણ ધરાવતા ઉમેદવારો (PH) તમામ કેટેગરીનાં

(૯) પસંદગી પ્રક્રિયા:- આ જાહેરાતમાં દર્શાવેલ સર્વગની જગ્યા ઉપર પસંદગી માટે હેતુલક્ષી પ્રશ્નનોવાળી ઓ.એમ.આર.(O.M.R.) પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષામાં કુલ ૧૦૦ પ્રશ્નો રહેશે. અને તે દરેકનો એક ગુણ રહેશે. દરેક સાચા જવાબ માટે ૧ ગુણ આપવામાં આવશે. અને દરેક ખોટા જવાબ માટે ૦.૨૫ ગુણ કાપવામાં આવશે. એટલે કે ખોટા જવાબ માટે નેગેટીવ ગુણની બાબત ઉમેદવારે ધ્યાને રાખવાની રહેશે. મૌખિક ઇન્ટરવ્યુ કે રૂબરૂમાં મુલાકાત લેવામાં આવશે નહિં. પરીક્ષા માટેના અભ્યાસ ક્રમની વિગતો નીચે મુજબની છે.

પરીક્ષા માટેના અભ્યાસક્રમની વિગતો

- ઃ આધુનિક ખેતી ઓજારો અને યાંત્રિક સાધનો , પિયત સાધનો અને સ્ત્રોત જળસિંચન , ફાર્મ મશીનરી, કાળજી અને સામાન્ય મુશ્કેલીઓ અને નિરાકરણ, ઉર્જા સ્ત્રોત
- ઃ પશુપાલન, પશુની વિવિધ જાતો, પશુ સંવર્ધન, મરઘા અને બતકા પાલનની કાળજી, રોગો અને ઉપચાર, પશુ પોષણ અને પશુ આહાર, પશુ ચિકિત્સા, દુધ અને દુધની બનોવટો, સાયલેજ
- ઃ પાક સંરક્ષણ, કીટકોની ઓળખ, ઉપયોગીતા, વર્ગીકરણ, ફાયદા કારક અને નુકશાન કારક કીટકો, કીટક નિયંત્રણ જંતુનાશકો અને તેના કાર્યો, પાકો અને તેની અગત્યની જીવાતો, પાક સંરક્ષણ સાધનો, રચના પ્રકાર, ભાગો અને ઉપયોગ, રોગોની ઓળખ અને તેના નિયંત્રણ
- ઃ બાગાયત શાસ્ત્ર, મુખ્ય બાગાયતી ફળ પાકોની (ફળ, શાકભાજી, ફુલ) ખેતિ પદ્ધતિ, વનસ્પતિ વર્ધન અને તેના પ્રકારો, ઉપયોગ, ઓજારો, વાવેતર પદ્ધતિઓ, કલમોની પદ્ધતિઓ, ફુલોધાન વિધા, નર્સરી , બાગાયત વિકાસની યોજનાઓ, કિચન ગાર્ડન, સફળ શાકભાજી ફળ પરિરક્ષણ, અંત:સ્ત્રાવનું મહત્વ, પેશી સંવર્ધન , બાગાયતમાં પ્લાસ્ટીકનો ઉપયોગ, ગ્રીન હાઉસ ટેકનોલોજી, શાકભાજી પાકો, જાતો, વાવેતર પદ્ધતિ, ઉત્પાદન, મુખ્ય રોગ-જીવાત અને તેનું નિયંત્રણ
- ઃ ખેતી પાકોનું વર્ગીકરણ, રાજ્યના ખેતી આબોહવા પ્રમાણેના વિભાગો/ખેતી હવામાનની પરિસ્થિતિ તથા જુદા જુદા ઝોન તેમજ મુખ્ય પાકોની માહિતી અને સમજ, બીજ અને માવજત
- ઃ જમીન વિજ્ઞાન, ગુણધર્મો , વર્ગીકરણ, જમીનના પ્રકાર અને વર્ગીકરણ, જમીન સુધારણા, પાક ઉપયોગી પોષકતત્વો, ખાતર અને વર્ગીકરણ/ પ્રકારો જમીન ધોવાણ અને સંરક્ષણ, જમીન પૃથ્થકરણ
- ઃ કૃષિ વિસ્તરણ, પદ્ધતિઓ, જરૂરીયાત, પ્રક્રિયા, જન સંપર્ક, નિદર્શનો, ઇન્ફોરમેશન ટેકનોલોજી, કૃષિ વિસ્તરણ સહકાર પ્રવૃત્તિઓમાં સ્થાનિક સંસ્થાઓનો પરિચય અને ફાળો, કૃષિ બાગાયત સંલગ્ન યોજનાઓ/કાર્યક્રમો, કૃષિ ધિરાણ.
- ઃ પાક ઉત્પાદન, ગુજરાતના મુખ્ય પાકો , બીજ ઉત્પાદન કાર્યક્રમ, નિંદણ તેના પ્રકાર અને નિયંત્રણ, લીલો પડવાસ, કૃત્રિમ વરસાદ, ધનિષ્ટ ખેતી, સુકી ખેતી, પાક ફેર બદલી, મિશ્રપાક અને આંતર પાક પદ્ધતિ
- ઃ ક્ષેત્ર વ્યવસ્થા હેતુ જમીનની ખરીદી અને પરિબળો, ખેત મજુર, ક્ષેત્ર આયોજન, સફળ ક્ષેત્ર વ્યવસ્થાપક ફાર્મ અંદાજપત્ર, ગામના ખેતી વિષયક નમુનાઓનો અભ્યાસ સર્વેક્ષણ, રૂતુવાર પાક - યોજના અને તૈયારી, ખેત આંકડાશાસ્ત્ર, પદ્ધતિઓ, અનાજ સંગ્રહ, ખેત મોજણી

ઃ બાયો ટેકનોલોજી, સમજ, મહત્વ, ટ્રાનઅજેનીક જાતો, ઉદાહરણ, ફાયદા, મર્યાદાઓ અને નિવારણ, મધમાખી ઉછેર, મશરૂમની ખેતી.

૧૦. સામાન્ય સુચનાઓ:-

- (૧) સદરહું ભરતી સંબંધી તમામ સુચનાઓ/વિગતો વખતો વખત વેબસાઇટ પરથી જોવા મળી શકશે.
- (૨) ઉમેદવારે નિયત અરજીપત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે. અને તેના પુરાવાઓ ભરતી પસંદગી સમિતિ/ખાતા દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજુ કરવાના રહેશે. અન્યથા અરજી પત્રક જે તે તબક્કે રદ ગણવામાં આવશે.
- (૩) ઉમેદવારે અરજીપત્રકમાં દર્શાવેલ કેટેગરી (જાતિ) માં પાછળથી કેટેગરી બદલવાની રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
- (૪) આ સંવર્ગની ભરતી પ્રક્રિયામાં આખરી પસંદગી પામેલ ઉમેદવાર નિમણૂક સત્તાધિકારી ઠરાવે તે શરતોને આધિન નિમણૂક મેળવવાને પાત્ર ઠરશે.
- (૫) ઉમેદવારે પોતે આખરી પસંદગી યાદીમાં સમાવિષ્ટ થવા માત્રથી સંબંધિત જગ્યા ઉપર નિમણૂક મેળવવાનો દાવો કરવાને હક્કદાર થશે નહીં. નિમણૂક કરનાર સત્તાધિકારને એવી ખાતરી થાય કે જાહેર સેવા માટે તે ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો ૧૯૬૭ થી ઠરાવેલ નિયમોનુસાર અને આ જગ્યાના પ્રવર્તમાન ભરતી નિયમો અનુસાર યોગ્ય જણાતો નથી તો તે તબક્કે આ ઉમેદવારને નિમણૂક ન આપવાનો નિર્ણય લઈ શકશે. અને આ બાબતે નિમણૂક સત્તાધિકારીનો નિર્ણય આખરી ગણાશે.
- (૬) O.M.R પરિક્ષા ફક્ત એલીમીનેશન માટે છે. ત્યાર બાદ શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવની ચકાસણી કરવામાં આવશે. અને તે આધારે નિમણૂક આપવા માટેની આગળની કાર્યવાહી કરવામાં આવશે. આમ ફક્ત O.M.R પરિક્ષામાં પ્રવેશ મળવાથી નિમણૂક માટેનો હક્ક આપો આપ મળવાપાત્ર રહેશે નહીં. .
- (૭) આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે બાગાયત મદદનીશ સંવર્ગ વર્ગ-૩ ના પ્રવર્તમાન ભરતી નિયમોને આધિન રહેશે.
- (૮) આ જાહેરાત કોઈપણ કારણોસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની કે જગ્યાઓનો સંખ્યામાં વધ-ઘટ કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો પસંદગી સમિતિને સંપૂર્ણ હક્ક/અધિકાર રહેશે અને આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં. તેમજ તેવા સંજોગોમાં ભરેલ પરીક્ષા ફી પરત મળવાપાત્ર થશે નહીં.
- (૯) (અ) સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ઉન્નત વર્ગમાં તેઓનો સમાવેશ થતો નથી તે મતલબનુ પ્રમાણપત્ર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૦૬/૦૨/૧૯૯૬ ના ઠરાવથી નિયત થયેલ પરિશિષ્ટ-ક મા તા:- ૩૧/૦૩/૨૦૧૨ ના રોજ પુરા થયેલ ૨૦૧૧ -૨૦૧૨ ના નાણાંકીય વર્ષની આવકને ધ્યાને લઈને તા:- ૩૧/૦૩/૨૦૧૨ પછીની તારીખનું યોગ્ય સત્તાધિકારીએ આપેલ હોવું જોઈએ અને આ પરિશિષ્ટ-ક નો નંબર અને તારીખ ઓનલાઇન અરજી વખતે દર્શાવવાનો રહેશે. પરિશિષ્ટ-ક ના સ્થાને એનેક્ષર-એ નુ પ્રમાણપત્ર માન્ય ગણાશે નહીં.
(બ) પરણિત મહિલા ઉમેદવારે આવું પ્રમાણપત્ર તેણીના માતા-પિતાની આવકના આધારે રજુ કરવાનું રહેશે. જો આવા ઉમેદવારોએ તેમના પતિની આવકના અધારે આવું પ્રમાણપત્ર રજુ કરેલ હશે તે તેમની અરજી રદ કરવામાં આવશે.
(ક) અરજી સાથે પરિશિષ્ટ-ક ને બદલે એનેક્ષર-એ (અંગ્રેજીમાં) રજુ કરેલ હશે તો પણ આવા ઉમેદવારની અરજી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની જગ્યા માટે માન્ય ગણવામાં આવશે નહીં.
- (૧૦) ગુજરાતના સરકારી કર્મચારી આ જાહેરાત સંદર્ભમાં બારોબાર અરજી કરી શકશે પરંતુ તેની જાણ ઉમેદવારે પોતાના મુળ તેમજ હાલના વિભાગ/ખાતા/કચેરીને દિન-૭ માં અચુક કરવાની રહેશે. જો ઉમેદવારના વિભાગ/ખાતા/કચેરી તરફથી અરજી મોકલવાની છેલ્લી તારીખ બાદ ૩૦ દિવસમાં અરજી કરવાની પરવાનગી નહીં આપવાની સમિતિને જાણ કરવામાં આવશે તો તેઓની અરજી ના મંજૂર કરી ઉમેદવારી રદ કરવામાં આવશે.

ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ (૧) થી (૧૨) અનુસરવાના રહેશે. કન્ફરમેશન નંબર મળ્યા પછી જ અરજી સંપૂર્ણ રીતે ભરાયેલ ગણાશે.

(૧૧) અરજી કરવાની રીત:-

આ જાહેરાતના સંદર્ભમાં એન.આઇ.સી ની <http://ojas.guj.nic.in> વેબસાઇટ મારફત ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવારે જાહેરાતમાં દર્શાવ્યા તારીખ: ૧૫/૦૩/૨૦૧૩ (બપોરે ૧૪:૦૦ કલાક) થી તારીખ: ૦૪/૦૪/૨૦૧૩ (રાત્રીના ૨૩:૫૯ કલાક સુધી) દરમિયાન <http://ojas.guj.nic.in> પર અરજીપત્રક ભરી શકાશે. ઉમેદવારે (૧) સૌ પ્રથમ કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટમાં વેબ સાઇટ <http://ojas.guj.nic.in> પર જવું. હવે (૨) Apply On line પર Click કરવાથી ભરવાપાત્ર જાહેરાતનો જાહેરાત ક્રમાંક, નામ અને અરજી કરવાની મુદતની વિગત દેખાશે. (૩) અરજી કરવા ઇચ્છતા ઉમેદવારે નીચે Apply now પર Click કરવાથી Application Format દેખાશે, Application Format માં સૌ પ્રથમ “ Personal Details ” ઉમેદવારે ભરવાની રહેશે.(અહીં લાલ કુંદડી (*) નિશાની હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.) (૪) Personal Details ભરાયા બાદ “ Educational Details ” ભરવા માટે Educational Details પર Click કરવું.(૫) Educational Details ભરાયા બાદ Experience Details પર Click કરવું (૬) હવે ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર (Exam Centre) પર ક્લિક કરવું. (૭) તેની નીચે Self declaration માં Yes / NO પર Click કરવું. (૮) હવે Save પર Click કરવાથી તમારી અરજીનો On line સ્વીકાર થશે. અરજીના સ્વીકારથી આપનો Application Number Generate થશે.જે ઉમેદવારે નોંધી લેવાનું અને તેને સાચવીને રાખવાનો રહેશે. (૯) હવે પેજના ઉપરના ભાગમાં Upload Photo પર Click કરો અહીં તમારો Application Number Ttype કરો અને તમારી BIRTH DATE TYPE કરો . ત્યાર બાદ OK પર ક્લિક કરો. અહીં Photo અને Signature Upload કરવાના છે. (ફોટોનું માપ ૫ સે.મી. ઉંચાઇ અને ૩.૬ પહોળાઇ અને Signature નું માપ ૨.૫ સે.મી. ઉંચાઇ અને ૭.૫ સે.મી.પહોળાઇ રાખવી.) (Photo અને Signature Upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature JPG Format માં (15 KB) Size થી વધારે નહિ તે રીતે Computer માં હોવા જોઇએ.) “Browse Button” પર click કરો. હવે Choose File ના સ્ક્રીનમાંથી જે ફાઇલમાં JPG Format માં તમારો Photo Store થયેલ છે,તે File ને Select કરો અને “ Open Button ” ને click કરો. હવે “Browse Button ની બાજુમાં “ Upload ” Button પર CLICK કરો, જેથી બાજુમાં તમારો Photo દેખાશે. હવે આજ રીતે Signature પણ Upload કરવાની રહેશે. (૧૦) હવે પેજના ઉપરના ભાગમાં “ Confirm Application ” પર CLICK કરો. જ્યાં “ Application Number ” તથા “Birth date type ” કર્યા બાદ Ok પર CLICK કરવાથી બે બટન (૧) Application Preview (૨) Confirm Application દેખાશે. ઉમેદવારે Application preview પર CLICK કરી પોતાની અરજી જોઇ લેવી.અરજીમાં સુધારો કરવાનો જણાય તો Edit Application ઉપર CLICK કરીને સુધારો કરી લેવો.અરજી Confirm કર્યા પહેલા કોઇ પણ પ્રકારનો સુધારો અરજીમાં કરી શકાશે. પરંતુ અરજી Confirm કર્યા બાદ કોઇ પણ પ્રકારનો સુધારો થઇ શકશે નહીં. જો અરજી સુધારવાની જરૂર ના જણાય તો જ Confirm Application પર CLICK કરવું. Confirm Application પર CLICK કરવાથી ઉમેદવારની અરજીનો પસંદગી સમિતિમાં On line સ્વીકાર થઇ જશે. અહીં “Confirmation Number ” Generate થશે. જે હવે પછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઇ,ઉમેદવારે સાચવવાનો રહેશે. Confirmation Number સિવાય કોઇપણ પત્રવ્યવહાર કે પરીક્ષાને લગતી કોઇપણ કાર્યવાહી કરી શકશે નહીં. આ નંબર ભવિષ્યમાં આ જાહેરાતના સંદર્ભમાં પસંદગી સમિતિ સાથેના કોઇપણ પત્ર વ્યવહારમાં સંદર્ભ તરીકે દર્શાવવાનો રહેશે.(૧૧) હવે Print Application પર CLICK કરવું.અહીં તમારો Confirmation Number ટાઇપ કરવો અને Print પર CLICK કરી અરજીની નકલ કાઢી સાચવી રાખવી. (૧૨) Confirm થયેથી તુરત જ અરજીમાં દર્શાવેલ મોબાઇલ નંબર ઉપર આપને SMS મળશે.આપના મોબાઇલ નંબર ઉપર પસંદગી સમિતિ દ્વારા આ જાહેરાત સંદર્ભે SMS થી જાણ કરવામાં આવશે. (૧૩) આ જાહેરાત સંબંધિત તમામ સુચનાઓ આપે અરજીમાં દર્શાવેલ મોબાઇલ નંબર ઉપર જ SMS થી જાણ કરવામાં આવશે. જેથી આ પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થાય નહીં ત્યાં સુધી આપનો મોબાઇલ નંબર બદલવો નહીં. અન્યથા પરીક્ષા સંબંધિત સુચનાઓ આપને નહીં મળે તો પસંદગી સમિતિની જવાબદારી રહેશે નહીં.

આ જાહેરાતમાં દર્શાવેલ જગ્યાના ભરતી નિયમો અન્વયે શૈક્ષણિક લાયકાત, વય-મર્યાદા, વયમર્યાદામાં છુટછાટ, પસંદગી પદ્ધતિની અને જાહેરાતની અન્ય તમામ વિગતો (૧) એન.આઇ.સીની વેબ સાઇટ <http://ojas.guj.nic.in> ઉપર (૨) કૃષિ અને સહકાર વિભાગ, ગાંધીનગરની વેબ સાઇટ <http://agri.gujarat.gov.in> ઉપર જોવા મળશે. ઉમેદવારે ઓન લાઇન અરજીપત્રકમાં બતાવેલી કોઇપણ વિગત અને ઉમેદવારે નિમણૂક સત્તાધિકારી સમક્ષ રજૂ કરેલ જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, વય, જાતિ, અન્ય લાયકાતોને લગતા પ્રમાણપત્રો ભવિષ્યમાં જે તે તબક્કે નિમણૂક અધિકારી દ્વારા ચકાસણી દરમ્યાન ખોટા માલુમ પડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આવા ઉમેદવારોની ઉમેદવારી નિમણૂક સત્તાધિકારી/ભરતી પસંદગી સમિતિના પરામર્શમાં રદ કરવામાં આવશે. તેમજ ઉમેદવારને ગેરલાયક ઠરાવવામાં આવશે. તેમજ આવા ઉમેદવારની જો પસંદગી / નિમણૂક થયેલ હશે તો સંબંધિત કચેરી દ્વારા ભરતી પસંદગી સમિતિના પરામર્શમાં કોઇપણ તબક્કે રદ કરવામાં આવશે. આ સંવર્ગની સીધી ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો-૧૯૬૭ અને વખતો વખત તેમાં થયેલા સુધારા અને તે અન્વયે આ સંવર્ગોના ભરતી નિયમો/પરીક્ષા નિયમોને આધિન રહેશે. આ જગ્યાની ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં કોઇપણ કારણસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો ભરતી પસંદગી સમિતિને સંપૂર્ણ હક્ક/અધિકાર રહેશે અને પસંદગી સમિતિ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં.

તારીખ: ૧૩/૦૨/૨૦૧૩

સ્થળ: ગાંધીનગર

અધ્યક્ષશ્રી

ખાતાકીય પસંદગી સમિતી અને

બાગાયત નિયામક

બાગાયત નિયામકની કચેરી,

ગુ.રા.ગાંધીનગર

વિનંતી પત્ર

જા.નં.બગત/વહટ/ક-પ/નમક/૧૦૦૬(૩)/ ૨૮૮૫ /૧૩

બાગાયત નિયામકની કચેરી, ગુ.રા.,
કૃષિભવન, સેક્ટર-૧૦- એ/ ગાંધીનગર
તારીખ: ૧૪/૨/૨૦૧૩

પ્રતિ,
રજનીશ મહાજનશ્રી,
સીનીયર ટેકનીકલ ડાયરેક્ટરશ્રી,
એન.આઇ.સી., બ્લોક નં.૧૩, બીજો માળ,
નવા સચિવાલય, ગાંધીનગર

વિષય:- બાગાયત મદદનીશ, વર્ગ-૩ ની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા બાબત
સંદર્ભ: ૧.ગુજરાત સરકારશ્રીના કૃષિ અને સહકાર વિભાગના પત્ર ક્રમાંક: બગમ/૧૦૧૨/
૬૨/ક.૮/તારીખ: ૨૮/૦૧/૨૦૧૩ તથા (૨) તા.૭/૨/૧૩ તથા (૩) તા.૮/૨/૧૩

માનનીયશ્રી,

સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, સંદર્ભ-૧ના પત્રથી બાગાયત ખાતાની બાગાયત મદદનીશ, વર્ગ-૩ ની ૪૭ ખાલી જગ્યાઓ પર સહાયક બાગાયત મદદનીશ તરીકે નિમણૂક આપવા, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના કાર્યક્ષેત્રમાંથી એક વખત બહાર લઇને ખાતા રાહે ભરવા માટે, ખાતાકીય પસંદગી સમિતિની રચના કરવામાં આવેલ છે, તથા આ મુક્તિ માત્ર એક ભરતી પ્રસંગ અથવા એક વર્ષ એ બે પૈકી જે વહેલું હોય તે પૂરતી આપવામાં આવેલ છે. તથા સંદર્ભ-૨ મુજબ દિન-૭માં જાહેરાત પ્રસિધ્ધ કરવા અને સંદર્ભ- ૩ના પત્રથી ત્રણ માસના સમયગાળા દરમિયાન સંબંધિત જગ્યાઓની ભરતીની કાર્યવાહી પૂરી કરવા જણાવેલ છે.

વધુમાં જણાવવાનું કે, બાગાયત મદદનીશ વર્ગ-૩ ની ૪૭ ખાલી જગ્યાઓ **OJAS** મારફત ઓન લાઇનથી અરજીઓ મેળવવા જણાવેલ હોય, મળેલ અરજીઓની ચકાસણી બાદ, ભરતી નિયમો તથા અન્ય પ્રવર્તમાન નિયમો અનુસાર લાયક ઉમેદવારો/અરજીઓની સંખ્યા ધ્યાને લઈ **OMR** પદ્ધતિથી પરીક્ષા લેવાની થાય છે.

બાગાયત મદદનીશ, વર્ગ-૩ ની ૪૭ ખાલી જગ્યાઓ ભરવા માટેની જાહેરાત તૈયાર કરવામાં આવેલ છે તથા જાહેરાતના મુદ્દા નં.(૯)માં પસંદગી પ્રક્રિયામાં હેતુલક્ષી પ્રશ્નોવાળી ઓ.એમ.આર. (**OMR**) પદ્ધતિથી પરીક્ષા લેવા અંગેનો અંગ્રેજી તથા ગુજરાતીમાં (અભ્યાસક્રમ) સીલેબસ તૈયાર કરી જાહેરાતમાં દર્શાવવામાં આવેલ છે.

ઉક્ત જણાવેલ જાહેરાત બાબતે અત્રેની કચેરીના મહેકમની કામગીરી સંભાળતા સંયુક્ત બાગાયત નિયામક, શ્રી, બી.યુ.પરમાર કે જેઓ પસંદગી સમિતિના સભ્ય સચિવશ્રી હોય, તેઓશ્રીના સંપર્ક માટે તેઓશ્રીનો કચેરીનો ફોન નંબર ૫૬૧૦૦ છે. ઓન લાઇન જાહેરાત માટેની અન્ય શરતો, તે અંગેના ખર્ચની વિગતો જણાવવા તેમજ જાહેરાત માટે તારીખ ફાળવવા વિનંતી છે.

સામેલ:- જાહેરાત

સહી/-
અધ્યક્ષશ્રી
ખાતાકીય પસંદગી સમિતી અને
બાગાયત નિયામક
બાગાયત નિયામકની કચેરી,
ગુ.રા.ગાંધીનગર.

